

વેચાણ દસ્તાવેજ

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) નાં દશકોઈ તાલુકાના મોજે ગામ સીંગરવાની સીમના બ્લોક/સર્વે નંબર ૫૪૦/૦૦૧ (જુના બ્લોક/સર્વે નં.૨૧૬) ની કુલ ચોરસમીટર ૧૯૨૮ જેનો સમાવેશ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર ૧૧૮ (સીંગરવા)માં થતાં તેને ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર ૧૦૦ ની કુલ ચોરસમીટર ૧૧૫૭ ની બિનખેતીની જમીનમાં **"ASTHA UNNATI"** એ નામથી ઓળખાતી યોજના આવેલ છે, જેમાં આવેલ ફ્લેટો/દુકાનો પૈકી બ્લોક: માં ફ્લોર ઉપર આવેલ ફ્લેટ નંબર: ની બાંધકામવાળી મીલકતનો વેચાણ દસ્તાવેજ રૂા...../- અંકે રૂપીયાપુરાનો.

વેચાણ આપનાર - એકતરફવાલા:-

"શ્રી હરી કોર્પોરેશન" ના પ્રોપરાઇટર તરીકે-

શ્રી સંજય રામચંદ્ર પટેલ

PAN No. ABDPP 0275 C

AADHAAR No. 3780 6774 0857

ભારતીય નાગરિક, પુણવયના, ધર્મે હિન્દુ, રહેવાસી: એ/૭, નિરાંત પાર્ક સોસાયટી, સન એન સ્ટેપ કલબની સામે, થલતેજ, અમદાવાદનાં.

જેને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં વેચાણ આપનાર અગર અમો એકતરફવાલા અગર લખી આપનાર એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દના અર્થમાં એકતરફવાલા તથા એકતરફવાલા વેચાણ આપનારનાં હાલના તથા વખતો વખતના વંશ, વાલી, વારસો, સક્સેસરો, એસાઈનીઓ, ટ્રાન્સફરીઓ, એડમીનીસ્ટ્રેટરો, મુખત્યારો ઇત્યાદી તમામનો સમાવેશ થાય છે. તે એકતરફવાલા.

અને

વેચાણ લેનાર - બીજીતરફવાલા:-

શ્રી

PAN No. ABDPP 0275 C

AADHAAR No. 3780 6774 0857

ભારતીય નાગરિક, પુણવયના, ધર્મે હિન્દુ, રહેવાસી:નાં.

જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં વેચાણ લેનાર અગર તમો અગર બીજીતરફવાલા એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં તમો વેચાણ લેનારનો તથા તમો વેચાણ લેનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એડમીનીસ્ટ્રેટરો, મુખત્યારો ઇત્યાદી તમામનો સમાવેશ થાય છે તે બીજીતરફવાલા.

વચ્ચે કરવામાં આવેલ છે.

-:: જત ::-

- ૧) રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) નાં દશક્રોધ તાલુકાના મોજે ગામ સીંગરવાની સીમના બ્લોક/સર્વે નંબર ૫૪૦/૦૦૧ (જુના બ્લોક/સર્વે નં.૨૧૬) ની કુલ ચોરસમીટર ૧૯૨૮ જેનો સમાવેશ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર ૧૧૮ (સીંગરવા) માં થતાં તેને ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર ૧૦૦ ની કુલ ચોરસમીટર ૧૧૫૭ ની બિનખેતીની જમીન અમો એકતરફવાલાની કુલ સ્વતંત્ર માલિકીપણાં કબજા ભોગવટાની આવેલી છે, અને તેવી જમીન સરકારી, અર્ધસરકારી રેકર્ડમાં તેમજ રેવન્યુ રેકર્ડમાં માલિક અને કબજેદાર તરીકે એકતરફવાલાના નામ ઉપર ચાલતી આવેલી છે, જેનું વિગતવાર વર્ણન આ સાથેના **પરિશીષ્ટ-૧** માં દર્શાવ્યા મુજબનું છે. અને જેને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં **“સદરહુ જમીન”** એ રીતે સંબોધવામાં આવેલ છે.
- ૨) સદરહુ રેવન્યુ સર્વે નંબર/બ્લોક નં.૫૪૦ ની કુલ ચોરસમીટર ૬૨૭૩ ની જમીન અમો લખી આપનારે તેનાં માલીકો (૧) ઠાકોર નાનજીભાઈ રાણાજી, (૨) ઠાકોર સાવધાનજી રાણાજી, (૩) ઠાકોર બુધાજી રાણાજી, (૪) લાખાજી ડાહ્યાજી, (૫) અમરાજી ડાહ્યાજી, (૬) છોટાજી ડાહ્યાજી, (૭) દિલીપભાઈ વજેસીંગ, (૮) મહેશજી માનસંગજી, (૯) સજનબેન તે કેશવલાલની વિધવા, (૧૦) કાળીદાસ અમરશી, (૧૧) હર્ષદભાઈ અમરશી તથા (૧૨) જયોત્સનાબેન કેશવલાલ એમ સર્વે પાસેથી વેચાણ રાખેલ, અને તે બાબતનો વેચાણ દસ્તાવેજ તારીખ ૨૬/૦૬/૨૦૧૮ ના રોજ અમદાવાદ-૧૪ (દશક્રોધ) ના મહેરબાન સબ-રજીસ્ટ્રાર સાહેબની કચેરીમાં અનુક્રમ નંબર ૨૧૫૦ થી રજીસ્ટર્ડ કરી નોંધાવવામાં આવેલ, અને તે બાબતની જરૂરી ફેરફાર નોંધ ગામ નમુના નંબર ૬ ના હક્કપત્રકમાં ફેરફાર નોંધ નંબર ૩૯૬૨ થી તારીખ ૨૬/૦૬/૨૦૧૮ ના રોજ પાડવામાં આવેલી છે., અને તે ફેરફાર નોંધ સક્ષમ અધિકારીશ્રી દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૧૮ નાં રોજ પ્રમાણિત કરવામાં આવેલ છે.

આમ ઉપરોક્ત હકિકતોની રુઈએ સદરહુ જમીનના અમો લખી આપનાર કુલ સ્વતંત્ર માલીક કબજેદાર ભોગવટેદાર પ્રસ્થાપીત થયેલા છીએ.

- ૩) સદરહુ જમીનનો બીનખેતીનો વપરાશ કરવા અંગેની પરવાનગી જીલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદનાએ તારીખ ૦૨/૧૧/૨૦૧૮ ના રોજ હુકમ ક્રમાંક નંબર- સી.બી./એન.એ./અમદાવાદ/સીંગરવા/૫૪૦/૯૯૫૧૭૬/૨૦૧૮ થી આપેલી છે, અને તે બાબતની જરૂરી ફેરફાર નોંધ ગામ નમુના નંબર ૬ ના હક્કપત્રકમાં ફેરફાર નોંધ નંબર ૪૦૬૩ થી તારીખ ૧૫/૧૨/૨૦૧૮ ના રોજ પાડવામાં આવેલી., અને તે ફેરફાર નોંધ સક્ષમ અધિકારીશ્રી દ્વારા તારીખ ૧૬/૦૨/૨૦૧૯ નાં રોજ પ્રમાણિત કરવામાં આવેલ છે.
- ૪) એકતરફવાલાએ સદરહુ જમીનમાં રહેણાંકના હેતુ સારુ ફ્લેટો તથા વાણીજ્યના હેતુસારની દુકાનોનું બાંધકામ કરવા અંગેના પ્લાન/નકશા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, અમદાવાદના દ્વારા તારીખ: ૨૯/૦૮/૨૦૧૯ ના રોજ રજાચિઠ્ઠી (વિકાસ માટે પરવાનગી) નંબર: **PRM/213/5/2019/398** થી **(Block No. A & B)** મંજૂર કરવામાં આવેલા છે.

ત્યારબાદ અમો વેચાણ આપનારે સદરહુ જમીન ઉપર મંજૂર કરવામાં આવેલ પ્લાન મુજબનું બાંધકામ કરવામાં આવેલ., જે યોજનાને અમો વેચાણ આપનાર દ્વારા **"ASTHA UNNATI"** એ નામની ઓળખ આપવામાં આવેલ, જેને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં **"સદરહુ યોજના"** એ રીતે સંબોધવામાં આવેલ છે.

- ૫) સદરહુ યોજનામાં રહેણાંકીય હેતુના ૫૬ ચુનીટ તેમજ વાણીજ્ય હેતુના ૪ ચુનીટ એમ મળી કુલ ૬૦ ચુનીટનું બાંધકામ કરવામાં આવેલ છે, તેમજ સદરહુ યોજનામાં સ્ટેર કેબીન તેમજ મશીનરૂમનું બાંધકામ કરવામાં

આવેલ છે, તેમજ સદરહુ યોજનામાં પાર્કીંગના હેતુ સારૂ સેલર/ભોયરૂ (૧) તથા ગ્રાઉન્ડ ફ્લોર (હોલો પ્લીનથ ઉપર) બાંધકામ કરવામાં આવેલ છે.

- ૬) સદરહુ યોજનાની નોંધણી અમો વેચાણ આપનારએ રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ-૨૦૧૬, અને ગુજરાત રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) (જનરલ) રૂલ્સ, ૨૦૧૭ મુજબ કરાવેલી છે, અને તે અંગેનું રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ રીયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરીટી દ્વારા તારીખ: / / ના રોજના રજીસ્ટ્રેશન નંબર: થી નોંધવામાં આવેલ છે, જેની નકલ આ સાથે **એનેક્ષર-એ** થી સામેલ કરેલ છે.
- ૭) સદર **"ASTHA UNNATI"** એ નામથી ઓળખાતી યોજનામાં આવેલ ફ્લેટો/દુકાનો પૈકી પ્લોટ: માં ફ્લોર ઉપર આવેલ ફ્લેટ નંબર: ની સમચોરસમીટર: કાર્પેટ એરીયા તથા સમચોરસમીટર: બાલ્કની તથા સમચોરસમીટર: વોશ એરીયા (સમચોરસમીટર: બિલ્ડઅપ એરીયા)ના બાંધકામવાળી મીલકત તથા સદરહુ યોજનામાં મુકવામાં આવેલ કોમન સીડી લીફ્ટ પેસેજના વરાડે પડતા વાપર ઉપયોગ કરવા સહીતની તથા તેમાં આવેલ ફીટીંગ લાઈટ, નળ, ગટર, કનેક્શન વિગેરે સહીતની મીલકત તથા સદરહુ યોજનાની રોડ રસ્તા તથા કોમન પ્લોટ સહીતની જમીન પૈકી સદર બાંધકામવાળી મીલકતના વરાડે પડતી વણવહેંચાયેલ હક્ક તથા હિસ્સાની સમચોરસમીટર: ની જમીન સહીતની મીલકત જેનું સંપૂર્ણ વર્ણન આ નીચે **પરીશીષ્ટ-૨** માં દર્શાવવામાં આવેલ છે, અને જેને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં **"સદરહુ મીલકત"** એ રીતે સંબોધવામાં આવેલ છે.
- ૮) અમો વેચાણ આપનારએ સદરહુ યોજના અંગે તમો વેચાણ લેનારને સંપૂર્ણ રીતે માહિતગાર કરેલ, અને અમો વેચાણ આપનારએ તમો

વેચાણ લેનારને બીનખેતીની મંજુરી, બાંધકામના મંજુર થયેલા પ્લાનો, જુના વેચાણ દસ્તાવેજોની નકલ, ટાઈટલ કલીયર સર્ટીફિકેટ વિગેરેની નકલો વેચાણ આપનારે વેચાણ લેનારને સોંપેલ છે, જે તમો વેચાણ લેનારએ વેચાણ આપનાર પાસેથી મેળવી વેચાણ લેનારએ જાતે તેમજ પોતાના એન્જીનીયરશ્રી/એડવોકેટશ્રી પાસેથી જોઈ તપાસી લીધેલ છે, અને તેની ચકાસણી કર્યા બાદ સદરહુ મીલકત વેચાણ રાખવા અંગેની જરૂરી ચર્ચા વિચારણા અમો વેચાણ આપનાર તથા તમો વેચાણ લેનાર વચ્ચે અવાર-નવાર કરવામાં આવેલ, અને તેવી ચર્ચા-વિચારણાના અંતે સદરહુ મીલકત તમો વેચાણ લેનારએ અમો વેચાણ આપનાર પાસેથી આ વેચાણ દસ્તાવેજની રૂઢએ વેચાણ રાખવાનું નક્કી કરેલ છે.

૯) ત્યારબાદ થયેલ ચર્ચા વિચારણાના અંતે સદરહુ મીલકત કુલ રૂા...../- અંકે રૂપીયા પુરાની કિંમતે તમો વેચાણ લેનારએ અમો વેચાણ આપનાર પાસેથી વેચાણ રાખવાનું નક્કી કરેલ છે, અને તે બાબતનો એક વેચાણ બાનાખતનો કરાર અમો વેચાણ આપનારએ તમો વેચાણ લેનારની તરફેણમાં તારીખ:ના રોજ લખી આપેલ, જે બાનાખત તેજ તારીખે અમદાવાદ-૧૨ (નિકોલ) ના મહેરબાન સબ-રજીસ્ટ્રાર સાહેબશ્રીની કચેરીમાં અનુક્રમ નંબર: થી રજીસ્ટર્ડ કરી નોંધવામાં આવેલ, અને સદર બાનાખતની રૂઢએ સદરહુ મીલકત તમો વેચાણ લેનારએ અમો વેચાણ આપનાર પાસેથી કુલ રૂા...../- અંકે રૂપીયા પુરાની વેચાણ કિંમતે વેચાણ રાખેલ છે, અને સદર વેચાણ અવેજની રકમ તમો વેચાણ લેનારએ નીચે દર્શાવેલ વિગતે અમો વેચાણ આપનારને ચુકવી આપેલ છે.

૧૦) અવેજની વિગત:-

રૂા...../- પુરા ચેક નંબર:, તારીખ:
ના રોજનો બેંક,,
શાખાનો અમો વેચાણ આપનારએ તમો વેચાણ

લેનાર પાસેથી સ્વીકારેલ છે તે.

એ રીતે કુલ રૂ./- અંકે રૂપિયા
..... પુરા સદરહુ મીલકતનાં ચુકતે વેચાણ અવેજના
વેચાણ લેનાર પાસેથી વેચાણ આપનારને મળેલા છે. (જે મલ્યા હોવાનું વેચાણ
આપનાર આથી કબુલ કરે છે અને તેની પહોંચ આથી સ્વીકારે છે.) આમ,
સદરહુ મીલકત વેચાણ આપનારએ વેચાણ લેનારને આથી કુલ અભરામ ન
દાવે અઘાટ વેચાણ આપેલ છે. તેમજ સદરહુ મીલકતનો માલીકી હક્કે ખાલી
અને પ્રત્યક્ષ કબજો વેચાણ આપનારે વેચાણ લેનારને આજરોજ સોંપેલો છે, જે
વેચાણ લેનારે જોઈ તપાસીને સંભાળી લીધેલો છે, અને વેચાણ લેનાર આથી
સદરહુ વેચાણ કબુલ મંજૂર રાખે છે, અને એ રીતે સદરહુ મીલકતના વેચાણ
લેનાર કુલ સ્વતંત્ર માલીક કબજેદાર બનેલા છે.

૧૧) સદરહુ યોજનાના મંજૂર કરવામાં આવેલ પ્લાન/નકશા પૈકીના ફ્લોર
પ્લાનની નકલ **એનેક્સર-બી** થી આ વેચાણ દસ્તાવેજ સાથે સામેલ
કરવામાં આવેલ છે.

૧૨) અમો વેચાણ આપનાર વધુમાં બાંહેધરી આપીએ છીએ કે, સદરહુ
મીલકત આજ અગાઉ અમો વેચાણ આપનારએ કોઈને કોઈપણ પ્રકારે
વેચાણ ગીરો બક્ષીસ કે અન્ય કોઈપણ પ્રકારે લખી આપેલ નથી તેમજ
સદરહુ મીલકત ઉપર અમો વેચાણ આપનારએ કોઈપણ પ્રકારની લોન
લઈ બોજો ઉત્પન્ન કરેલ નથી અને સદરહુ મીલકતમાં વેચાણ આપનાર
સિવાય બીજા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક હીસ્સો
નથી, આમ સદરહુ મીલકત પરત્વેના અમો વેચાણ આપનારના રાઈટ
ટાઈટલ્સ ચોખ્ખા કલીયર અને માર્કેટેબલ છે અને સદરહુ મીલકત અમો
વેચાણ આપનારને વેચવા, સાટવા તેમજ ટ્રાન્સફર, એસાઈન કરવાનો
કાયદેસરનો હક્ક અને અધિકાર છે, અને તેવા હક્ક અધિકારની
રૂઈએ સદરહુ મીલકત અમો વેચાણ આપનારએ તમો લખાવી લેનારને
આજરોજ આ વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે.

- ૧૩) સદરહુ મીલકત વેચાણ આપનારે કોઈને વેચવી-વેચાવવી નહીં કે ટ્રાન્સફર કે એસાઈન કરવી-કરાવવી નહીં કે કોઈના કબજે સોંપવી-સોંપાવવી નહીં તેવો કોઈપણ જાતનો મનાઈ હુકમ વેચાણ આપનાર પર નીકળેલો નથી કે મળેલો કે બજેલો નથી., તેમજ સદરહુ મીલકત વેચાણ લેનારને વેચાણ આપવાનો વેચાણ આપનારને પુરતો સંપૂર્ણ હક્ક અને અધિકાર છે., હવેથી સદરહુ મીલકતનો આ વેચાણ દસ્તાવેજમાં જણાવેલ શરતો અને જવાબદારીઓને આધીન રહીને જ વેચાણ લેનાર તેમનું દિલ ચાહે તેમ ઉપયોગ અને ઉપભોગ કરવા-કરાવવા આથી હક્કદાર છે.
- ૧૪) સદરહુ યોજનામાં કોમન એરીયા તથા ફેસીલીટી વિગેરેની વ્યવસ્થા સારૂ વેચાણ આપનાર દ્વારા સોસાયટી/સર્વિસ સોસાયટી/ એસોસીએશનની રચના કરવામાં આવનાર છે, જેમાં વેચાણ લેનારએ ફરજિયાત પછે સભ્ય તરીકે દાખલ થવાનું છે, તેમજ સોસાયટી/સર્વિસ સોસાયટી/એસોસીએશન દ્વારા જે કાંઈ નિતિ-નિયમો ઘડવામાં આવે તેનું વેચાણ લેનારએ ફરજિયાતપછે પાલન કરવાનું રહેશે, અને તેવી સોસાયટી/સર્વિસ સોસાયટી/એસોસીએશનની નોંધણી કરાવવા સારુ વેચાણ લેનારની જ્યાં જ્યાં સહીઓ, સંમતીઓ આપવાની જરૂરીયાત આપવાની થાય ત્યાં ત્યાં વેચાણ લેનારએ સહીઓ, સંમતીઓ કરી આપવાની છે અને રહેશે, તેમજ સોસાયટી/સર્વિસ સોસાયટી/ એસોસીએશન દ્વારા વખતો વખત મેઈન્ટેનન્સની જે રકમ નક્કી કરવામાં આવે તે રકમ વેચાણ લેનારએ ભરવાની રહેશે.
- ૧૫) વેચાણ આપનાર વેચાણ લેનારને વધુમાં બાંહેધરી આપે છે કે, સદરહુ મીલકતનો ફક્ત કાયદાની જોગવાઈઓ મુજબ ઉપયોગ કરવા સારૂ વેચાણ લેનારને વેચાણ આપેલ છે, હવેથી સદરહુ મીલકત અસલ હદ હક્કો મુજબની તેમજ અમો વેચાણ આપનારના જે જે હક્કો હોય તે તે તમામ હક્કો સાથેની ચાંદો, સુરજ તપે ત્યાં સુધીની વેચાણ લેનાર ભોગવે, વેચે, સાટે ગીરો, બક્ષીસ આપે, ચા તેમનું દીલ ચાહે તેમ ઉપયોગ કરવા કરાવવા માટે આથી હક્કદાર છે, વેચાણ આપનાર

વેચાણ લેનારને વધુમાં બાંહેધરી આપે છે કે, સદરહુ મીલકત પરત્વે હવે પછી અમો વેચાણ આપનારને કોઈપણ પ્રકારનો હક્ક અધિકાર રહ્યો નથી.

- ૧૬) સદરહુ ફાળવેલ/વેચાણ આપેલ મિલકતના બાંધકામમાં સ્ટ્રક્ચર ખામી અથવા વર્કમેનશીપ અથવા માલ-સામાનની ગુણવત્તા અથવા સેવાની જોગવાઈ બાબતે કે ડેવલોપમેન્ટ સબંધે કે બુકીંગ એગ્રીમેન્ટની સમજૂતી મુજબ એકતરફવાલા/વેચાણ આપનારના અન્ય બંધનો, ફરજો અંગેની ખામી બીજીતરફવાલા/વેચાણ લેનાર દ્વારા કબજો સોંપ્યાની તારીખથી ૫ વર્ષના સમયગાળાની અંદર એકતરફવાલા/વેચાણ આપનારની ફરજ બનશે કે આવી ખામીઓ સુધારી આપવાની છે અને રહેશે., પરંતુ સદરહુ મિલકતમાં વેચાણ લેનાર પોતે કે પોતાના પ્રતિનિધી મારફતે સ્ટ્રક્ચર કે તેના મુળભુત માળખામાં/બાંધકામમાં કે ફીટીંગ્સમાં કોઈપણ ફેરફાર કે તોડફોડ કરેકરાવે અને તેથી કરીને બિલ્ડીંગ, ફીટીંગ્સ કે સ્ટેબીલીટીમાં ખામી સર્જાય તો તે અંગે એકતરફવાલા/લખી આપનારને જવાબદાર ગણાવી શકાશે નહીં, અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી બીજીતરફવાલા/વેચાણ લેનારની છે અને રહેશે.

આ શરતે કે વેચાણ આપનાર/પ્રમોટર તેવા કોઈ કારીગરલક્ષી કાર્યો, ગુણવત્તા અથવા સુવિધાની જોગવાઈમાં રહેલ ખામીઓ અથવા માળખાકીય ખામીઓ માટે જવાબદાર નહીં ઠરે જેના માટે તેઓ જવાબદાર હોય અથવા જે પ્રમોટરના નિયંત્રણ બહાર હોય. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે બીજીતરફવાલા/વેચાણ લેનારને જાણ છે કે પાણી જે સહેલાઈથી છટકે તેવો પ્રવાહી પદાર્થ છે તે ગમે તેટલા પગલા લેવામાં આવે તો પણ પાઇપના સાંધામાંથી તથા ટાઇલીસના સાંધામાંથી ચુકે છે. આવું લીકેજ બાંધકામની ગુણવત્તા સીવાય પણ સંભવી શકે છે જેવા કે ટાઇલ્સ ઘોવા માટે એસીડનો વધારે પડતો ઉપયોગ, વોશીંગ મશીનની ધુબારી, ગરમ તથા સખત પાણી, રફ ઉપયોગ વિગેરે હોઈ શકે તેથી ભવિષ્યમાં સદર ચુનિટ/ફ્લેટ/દુકાન/મિલકતનો કોઈપણ જગ્યાએ પાણી લીકેજ દિવાલ

ચુલે તો તે માટે લેચાલ લેનાર લેચાલ આપનાર/પ્રમોટરને જવાબદાર ગણશે નહીં.

- ૧૭) સદરહુ મીલકત તમો લેચાલ લેનાર રેવન્યુ રેકર્ડમાં તથા અન્ય સરકારી અર્ધસરકારી કચેરીઓના રેકર્ડમાં પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેશે, અને તે અંગે અમો લેચાલ આપનારની જ્યાં જ્યાં સહીઓ, અરજી, જવાબો, કબુલાતો, તથા સ્ટેટમેન્ટોની જરૂર પડે તો તે અમો લેચાલ આપનાર તમો લેચાલ લેનારને આપવા આથી બંધાયેલ છીએ.
- ૧૮) અમો લેચાલ આપનાર વધુમાં જણાવીએ છીએ કે, સદરહુ ચોજનામાં આવેલ કોમન એમેનીટીઝ, લીફ્ટ, નિસરણી વિગેરેનો ઉપયોગ સદરહુ ચોજનાના તમામ સભાસદોએ જ કરવા-કરાવવાનો છે અને રહેશે, અને તે પ્રમાણે વર્તવા લેચાલ લેનાર સંમત થયેલા છે.
- ૧૯) અમો લેચાલ આપનાર વધુમાં જણાવીએ છીએ કે, સદરહુ ચોજનામાં આવેલ તમામ કોમન એમેનીટીઝની જગ્યામાં તથા બ્લોકના પેસેજ તથા ફોયરની જગ્યામાં લેચાલ લેનારે કોઈ ચીજ વસ્તુઓ મુકવાની નથી કે તેવી તમામ કોમન એમેનીટીઝની જગ્યામાં તથા બ્લોકના પેસેજ તથા ફોયરની જગ્યામાં કોઈ કચરો કે નકામી વસ્તુઓ લેચાલ લેનારે નાંખવાની નથી, કે તેવી જગ્યામાં લેચાલ લેનારે કોઈપણ પ્રકારની ગંદકી પણ કરવાની નથી, તેમજ તેવી તમામ કોમન એમેનીટીઝની જગ્યામાં તથા બ્લોકના પેસેજ તથા ફોયરની જગ્યામાં અન્ય મેમ્બર્સને પજવણી, એનોયન્સ, ન્યુસન્સ થાય તેવું કોઈ કૃત્ય લેચાલ લેનારે કરવા-કરાવવાનું નથી.
- ૨૦) સદરહુ રહેણાકીય હેતુના ફ્લેટમાં આવેલ બાલ્કની લેચાલ લેનારે ક્યારેય પણ કોઈપણ રીતે કવર કરવા-કરાવવાની નથી, તેમજ લેચાલ લેનારે તેમના ફ્લેટ/દુકાનની બહારની બાજુએ આવેલ/દેખાતી દિવાલોનાં કલર સ્કીમમાં, તેમજ બાલ્કનીનાં કલર સ્કીમમાં/નિસરણી, નિસરણીની

બાજુમાં આવેલ દિવાલોમાં તથા ફોયરની જગ્યાનાં કલર સ્કીમમાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર ક્યારેય પણ કરવા-કરાવવાનો નથી, તેમજ સદરહુ મીલકતમાં બહારની બાજુએ આવેલ એલીવેશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર વેચાણ લેનારે ક્યારેય પણ કરવા કરાવવાનો નથી, જે તમામ હકીકત વેચાણ લેનાર સ્પષ્ટપણે કબુલ મંજૂર રાખે છે.

૨૧) સદરહુ યોજનામાં રહેણાકીય હેતુના ફ્લેટોનો વેચાણ લેનારે ફક્ત રહેણાંકના હેતુ સારૂ જ ઉપયોગ અને ઉપભોગ કરવા-કરાવવાનો છે, એટલે કે વેચાણ લેનારે ક્યારેય પણ કોમર્શીયલ કે અન્ય કોઈપણ રીતે ઉપયોગ કરવા-કરાવવાનો નથી., તેમજ મજકુર મીલકતમાં કાયદા અને સમાજ વિરોધી કોઈ કૃત્યો વેચાણ લેનારે કરવા-કરાવવાનાં નથી, તેમજ તુર્તજ સળગી ઉઠે તેવા દાહક પદાર્થો, પ્રતિબંધીત ચીજ વસ્તુઓ રાખવાની કે મુકવાની નથી, તેમજ બીલ્ડીંગ અને પ્રિમાઈસીસને કોઈપણ રીતે નુકશાન થાય તેવી કોઈ પ્રવૃત્તિઓ કે કાર્યવાહીઓ પણ વેચાણ લેનારે કરવા-કરાવવાની નથી, તેમજ સદરહુ મીલકતનો વેચાણ લેનારે ફરજિયાત પણે વિમો ઉતરાવવાનો છે અને રહેશે.

૨૨) વેચાણ આપનાર વેચાણ લેનારને વધુમાં જણાવે છે કે, સદરહુ મીલકત અંગેના સરકારી, અર્ધસરકારી, સ્થાનિક સંસ્થાઓનાં અન્ય જે કાંઈ વેરાઓ ટેક્ષો, મહેસુલ તથા ઈલેક્ટ્રીક બર્નીંગ બીલની રકમ વિગેરે ભરવાનાં આવેલ છે તે તમામ વેચાણ દસ્તાવેજની તારીખ સુધીના અમો વેચાણ આપનારએ ભરી દીધેલા છે અને તેવા કોઈપણ જાતના વેરાઓ તથા ઈલેક્ટ્રીક બર્નીંગ બીલની રકમ વિગેરે ભરવાના બાકી નથી તેમ છતાં વેચાણ દસ્તાવેજની તારીખ પહેલાંના તેવા કોઈપણ વેરાઓ તથા ઈલેક્ટ્રીક બર્નીંગ બીલની રકમ ભરવાના બાકી હોય તે પાછળથી ભરવાનાં આવે તેવા તમામ વેરાઓ તથા ઈલેક્ટ્રીક બર્નીંગ બીલની રકમ વિગેરે અમો વેચાણ આપનારએ ભરવાનાં છે, અને વેચાણ દસ્તાવેજની તારીખથી સદરહુ મીલકત અંગેના તમામ વેરાઓ તથા ઈલેક્ટ્રીક બર્નીંગ બીલની રકમ વિગેરે વેચાણ લેનારે ભરવાનાં છે.

- ૨૩) વેચાણ લેનાર આથી કબુલ કરે છે કે, હવે પછી સદરહુ મીલકત ઉપર ભવિષ્યમાં સરકાર દ્વારા વખતો વખત સરકારશ્રીના કાયદામાં ફેરફાર થવાના કારણે જે કોઈ નવા ચાર્જ, વેરા, ટેક્સ, ખર્ચ તથા અન્ય કોઈપણ કરવેરા કે રકમો વિગેરે સરકારશ્રીમાં ભરવાની આવે તે તમામ વેચાણ લેનારે ભરવાના છે.
- ૨૪) સદર **"ASTHA UNNATI"** ના નામથી ઓળખાતી યોજનાનાં મંજુર થયેલા પ્લાનો મુજબ એકતરફવાલા બીજીતરફવાલાને આ વેચાણ દસ્તાવેજથી વધુમાં જણાવે છે કે, સદરહુ પ્રોજેક્ટના બ્લોક "એ" અને "બી" ના સાતમાં માળના ઉપરના ભાગે જે ધાબુ/ટેરેસ આવેલ છે, તે ધાબા/ટેરેસનો વપરાશ સદરહુ યોજનાના તમામ સભાસદોએ સાથે મળીને સહીયારી રીતે કરવાનો છે અને રહેશે., અને તેવા ધાબા/ટેરેસના વપરાશ બાબતે બીજીતરફવાલાએ કચાચે કોઈપણ પ્રકારની તકરારો ઉપસ્થિત કરવા કરાવવાની છે નહીં કે રહેશે નહીં, અને તેવા કોમન વપરાશી ધાબા/ટેરેસ ઉપર સદરહુ યોજનાના કોઈપણ સભાસદોએ કોઈપણ પ્રકારનું કાર્ય પાકુ બાંધકામ કરવા/કરાવવાનું નથી.
- ૨૫) અમો વેચાણ આપનાર તમો વેચાણ લેનારને વધુમાં જણાવીએ છીએ કે, વેચાણ લેનારએ સદરહુ મીલકતની વેચાણ અવેજની કિંમત ઉપરાંત મેઈન્ટેનન્સ, મેઈન્ટેનન્સ ડિપોઝીટ, એ.ઈ.સી, એ.એમ.સી., ઓડા વિગેરે તેમજ જીએસટી તથા અન્ય ચાર્જિસ/વેરાઓ અમો વેચાણ આપનારને અલગથી ચુકવી આપવાના રહેશે.
- ૨૬) અમો વેચાણ આપનાર તમો વેચાણ લેનારને વધુમાં જણાવીએ છીએ કે, સદરહુ યોજનાના સભ્યો/મેમ્બરો/વેચાણ લેનાર તેમના વાહનો સુવ્યવસ્થિત રીતે પાર્કિંગ કરી શકે તે માટે ગ્રાઉન્ડ ફ્લોર પરની હોલો પ્લીન્થની ખુલ્લી જગ્યામાં તેમજ ભોંયરૂં (બેઝમેન્ટ)-૧ માં પાર્કિંગ તૈયાર કરેલ-કરાવેલ છે., તેવા કોમન પાર્કિંગમાં જ બીજીતરફવાલા સભ્યો/મેમ્બરોએ તેમના વાહનો પાર્ક કરવાના રહેશે., તેમજ સદરહુ યોજનામાં

આવેલ દુકાનોના માલીકોએ તેમના વાહનો દુકાનોની આગળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરવાના છે અને રહેશે, અને તેવી પાર્કિંગની વ્યવસ્થા બાબતે વેચાણ લેનાર/સભ્યો/મેમ્બરો દ્વારા ક્યારેય કોઇપણ પ્રકારના વાંધા તકરારો ઉપસ્થિત કરવા-કરાવવાના રહેશે નહીં.

૨૭) વેચાણ આપનાર વેચાણ લેનારને વધુમાં જણાવે છે કે, હવે પછીથી સદરહુ મીલકતના તમામ પ્રકારના વેરાઓ વેચાણ લેનારએ ચુકવવાના છે, તેમજ સદરહુ જમીનનો મહેસુલ કર વગર વહેંચાયેલ જમીનના હક્કો અનુસાર ચુકવવાના છે અને રહેશે, તેમજ એજ્યુકેશન સેસ, પાણી વેરો વિગેરેની રકમ પણ વેચાણ લેનારએ ચુકવવાની છે, અને તેની જવાબદારી તમામ સભ્યોની જોઈન્ટ એન્ડ સેવરલ છે અને રહેશે, તેમજ સદરહુ યોજનાના રોડ-રસ્તા તથા સીડી, પેસેજની જગ્યા વિગેરેમાં પ્રકાશ સાઈન રાખવામાં આવેલી કોમન લાઈટોનું બળતણ ખર્ચ અને બોરમાંથી પાણી મેળવવાનો ખર્ચ, ઇલેક્ટ્રીક મોટરના બળતણનો ખર્ચ અને તેના નિભાવ ખર્ચ તેમજ ચોક્કીદાર અને સાફ-સફાઈના ખર્ચા, તેમજ સદરહુ યોજનાની જાળવણીનો ખર્ચ તેમજ આ વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય પરંતુ સહીયારી ચુકવવાની થતી હોય તેવી તમામ રકમો વેચાણ લેનારે ચુકવવાની છે અને રહેશે.

૨૮) સદરહુ યોજનાની બી.યુ. પરમીશન મેળવ્યા અગાઉ સરકારશ્રી દ્વારા નિતિ-નિયમોમાં ફેરફાર કરવામાં આવે, અને તે મુજબ સદરહુ યોજનામાં એક્ઝેસઆઈ મુજબ વધુ બાંધકામ મળે તો વેચાણ આપનાર તેમનાં ખર્ચે સદરહુ યોજનામાં નોંધાયેલા સભાસદોમાંથી ૨/૩ જેટલા સભાસદોની મંજૂરી મેળવી તેવા એક્ઝેસઆઈ મુજબના પ્લાનો રીવાઈઝ કરાવી શકશે, અને તે અંગે રેરા રજીસ્ટ્રેશનની કલમ ૧૪ અન્વયે રેરા પ્રમાણપત્ર રીવાઈઝ વેચાણ આપનારે તેમનાં ખર્ચે કરાવવાનું છે અને રહેશે., અને સદરહુ યોજનાની બી.યુ. પરમીશન આવ્યા બાદ એક્ઝેસઆઈ તેમજ કોમન એરીયા તથા ધાબા/ટેરેસ અંગેનાં તમામ હક્કો સર્વિસ સોસાયટીના રહેશે.

૨૮.૧.) સદરહુ ચોજનાની જમીનમાં વેચાણ લેનારનો પોષાતો વણવહેંચાયેલ હક્ક તથા હિસ્સો આવેલો છે., પરંતુ ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવે તેવા નિયમોનુસાર વેચાણ લેનારના તેવા વણવહેંચાયેલ હક્ક હિસ્સામાં તજાવત આવી શકે છે.

૨૯) વેચાણ આપનારે વેચાણ લેનારને પરિશીષ્ટમાં દર્શાવ્યા મુજબની બાંધકામવાલી મીલકત જ વેચાણ આપેલ છે, જેથી મજકુર મીલકતનો આંતરિક બીલ્ડઅપ એરીયા જ સ્વતંત્ર રીતે વાપરવાનો વેચાણ લેનારને હક્ક છે, તેમજ તેવી વગર વહેંચાયેલ જમીનની વહેંચણી કરીને અલગથી જમીન માંગવાનો કે મેળવવાનો વેચાણ લેનારને કોઈ હક્ક કે અધિકાર નથી, વધુમાં મજકુર મીલકતમાં કોઈ સુધારો-વધારો કરવાનો તથા બારી-બારણા- વેન્ટીલેશન વિગેરેની સ્થળ સ્થિતિમાં ફેરફાર કરવાનો વેચાણ લેનારને કોઈ હક્ક નથી, તેમ છતાં વેચાણ લેનાર જો કોઈપણ પ્રકારના અનઅધિકૃત ફેરફાર/સુધારા-વધારા કરે-કરાવે તો તે તમામ વેચાણ આપનાર વેચાણ લેનારનાં ખર્ચે અને જોખમે યથાવત સ્થિતિમાં કરાવવા હક્કદાર રહેશે, અને તે અંગે કોઈ દાદ, ફરીયાદ કે તકરાર કરવાનો વેચાણ લેનારને કોઈ હક્ક કે અધિકાર રહેશે નહીં., તેમજ તે અંગે કોઈપણ પ્રકારની નુકશાની માંગવાને કે મેળવવા પણ વેચાણ લેનાર હક્કદાર રહેશે નહીં. સદરહુ મીલકતની આંતરિક દિવાલો, ફ્લોર, છત, વિગેરે અન્ય મીલકતો સાથે સહીયારી માલીકીની અને તેનાં માલીક કબજેદારો સાથે સહીયારી વપરાશની છે, મજકુર મીલકતનો અંદરનો ભાગ તથા બહારનો ભાગ સંપૂર્ણ સુંદર, સારી અને સંગીન હાલતમાં રાખવાની અને મેઈન્ટેન કરવાની જવાબદારી વેચાણ લેનારની છે અને રહેશે, સહીયારી દિવાલ, ફ્લોર, છત વિગેરેમાં નુકશાન થાય અગર તેની મજબુતાઈને કોઈ અસર થાય તેવા કોઈ કૃત્યો વેચાણ લેનારે કરવા-કરાવવાના નથી.

૩૦) સદરહુ જમીન/સદરહુ મીલકત અંગે ભવિષ્યમાં ઔડા/એએમસી, લોકલ ઓથોરીટીઝ વિગેરે બેટરમેન્ટ ચાર્જ અગર તે પ્રકારનો અન્ય કોઈ ચાર્જ

નાંખે અને તેવી જે રકમ ભરવાની આવે તે રકમ પૈકી મજકુર મીલકતનાં વરાડે આવતી રકમ વેચાણ લેનારે ભરવાની રહેશે.

- ૩૧) વેચાણ લેનારને સદરહુ મીલકતના બાંધકામમાં વપરાયેલ માલ-સામગ્રીની ગુણવત્તા બાબતે કે સદરહુ યોજનાના પ્લાન, સ્પેશીફીકેશનો તથા યોજનાની ડીઝાઇન બાબતે કોઈપણ પ્રકારની ફરિયાદ કે તકરાર નથી. વેચાણ લેનારે સદરહુ મીલકતના માપ-ક્ષેત્રફળ બાબતે જરૂરી ચકાસણી કરેલ છે., તેમજ સદર ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર હોય તેમાં આવેલ તમામ સગવડો-સુવિધાઓ જેવી કે, પાણી, ગટર, ઇલેક્ટ્રીસીટી, પ્લમ્બીંગ તથા અન્ય જરૂરી સુખ-સુવિધાઓ વેચાણ લેનારે જોઈ ચકાસી લીધેલ છે અને તે અંગે વેચાણ લેનારને સંપૂર્ણ સંતોષ છે, અને તેની ગુણવત્તા અંગે વેચાણ લેનારને કોઈપણ પ્રકારના વાંધા-તકરાર નથી, જેની આથી વેચાણ લેનાર પાકી ખાત્રી તેમજ બાંહેધરી આપીએ છીએ.
- ૩૨) સદરહુ મીલકત ખરીદવા સારૂ વેચાણ લેનારએ જે રકમો વેચાણ આપનારને ચુકવેલ છે, તેવી તમામ રકમોની પહોંચ તમો વેચાણ લેનારએ અમો વેચાણ આપનાર પાસેથી મેળવી લીધેલ છે, તે સિવાય અન્ય કોઈ પહોંચો વેચાણ લેનારએ વેચાણ આપનાર પાસેથી મેળવવાની બાકી રહેતી નથી, તે હકીકત વેચાણ લેનાર આથી કબુલ રાખે છે.
- ૩૩) આ વેચાણ દસ્તાવેજની કોઈપણ જોગવાઈ, ઉક્ત અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને વિનિયમો હેઠળ અથવા લાગુ પડવાપાત્ર અન્ય કાયદાઓ હેઠળ રદ કરવા અથવા બિનઅમલપાત્ર બનાવવાનું નક્કી કરવામાં આવે તો, આવી જોગવાઈઓ, તે આ વેચાણ દસ્તાવેજના હેતુ સાથે અસંગત હોય એટલા પુરતી અને આ અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અથવા લાગુ પડતા કાયદાઓ સાથે તે અનુરૂપી હોવી જરૂરી હોય તેટલા પ્રમાણમાં તે સુધારાયેલી અથવા રદ થયેલી ગણાશે અને આ વેચાણ દસ્તાવેજની બાકીની જોગવાઈઓ, આ વેચાણ દસ્તાવેજના અમલ વખતે લાગુ પડતી હતી એ

જ રીતે માન્ય અને અમલપાત્ર રહેશે.

- ૩૪) સદરહુ યોજનામાં આવેલ યુનીટોનો વપરાશ કરવાની પરવાનગી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, અમદાવાદ કચેરીમાંથી મેળવવાની છે., જેથી સદરહુ મીલકતના વપરાશ અંગેની પરવાનગી આવેથી વેચાણ લેનારે સદરહુ મીલકતનો વપરાશ કરવાનો છે અને રહેશે., પરંતુ તેવી પરવાનગી મેળવવામાં જો કોઈપણ કારણોસર વિલંબ થાય તો તે અંગેની કોઈપણ જવાબદારી વેચાણ આપનારની રહેશે નહીં.
- ૩૫) સદરહુ મીલકત અંગે ઉદભવતા કોઈપણ પ્રકારના વિવાદનું નિરાકરણ બંને પક્ષકારોએ સુમેળથી લાવવાનું છે, અને જો કોઈ તકરારનું નિવારણ સુમેળથી લાવી શકાય તેમ ન હોય તો રીયલ એસ્ટેટ સંબંધી (નિયમન અને વિકાસ) અધિનિયમ, ૨૦૧૬ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને વિનિયમોની જોગવાઈઓ હેઠળ સત્તામંડળને મોકલી આપવાની રહેશે, અને સદરહુ મીલકત અન્વયે ભવિષ્યમાં કોઈ કાયદાકીય વાંધા તકરારો કે દાવાદુવી ઉપસ્થિત થાય તો તે અંગેની કોર્ટ-કચેરીનું ન્યાયિક ક્ષેત્ર અમદાવાદ રહેશે.
- ૩૬) આ દસ્તાવેજમાં જણાવેલ તમામ શરતો અને સમજુતીઓનું પાલન વેચાણ લેનારે તથા તેના માણસો, મુખત્યારો, વહીવટકર્તાઓ ઇત્યાદી તમામે સંપૂર્ણપણે કરવાનું રહેશે., પરંતુ જો વેચાણ લેનાર તેવી શરતો અને સમજુતીઓનું પાલન કરવામાં આનાકાની કરે અગર તો તેનો ભંગ કરે અને તેને લીધે વેચાણ આપનારને કોઈપણ જાતના ખર્ચ, નુકશાન ઇત્યાદીમાં ઉતરવું પડે તો તેવું ખર્ચ, નુકશાન ઇત્યાદી તમામ વેચાણ આપનાર વેચાણ લેનાર પાસેથી વસુલ કરવાને હક્કદાર રહેશે. વેચાણ લેનારે સદર દસ્તાવેજમાં જણાવેલ તમામ શરતો જોઈ સમજુ વાંચી લીધેલ છે, અને જે તમામ શરતો, સમજુતીઓ વેચાણ લેનારને કબુલ મંજુર અને બંધનકર્તા રહેશે.

- ૩૭) આ વેચાણ દસ્તાવેજ અંગેનો તમામ ખર્ચ જેવોકે સ્ટેમ્પ , રજીસ્ટ્રેશન ફી , ટાઈપીંગ ખર્ચ , વકીલ ફી તથા સોસાયટીની ટ્રાન્સફર ફી તથા વેલ્યુએશન અંગે ભરવાની આવતી ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઈત્યાદી તમામ વેચાણ લેનાર એકલાએ ભોગવેલ છે.
- ૩૮) એ રીતેનો ઉપર મુજબનો આ વેચાણ દસ્તાવેજ અમો વેચાણ આપનારે અમારી રાજીખુશીથી તથા અક્કલ હોંશીયારીથી વાંચી , વંચાવી , સમજી વિચારીને કોઈનાં કોઈપણ જાતનાં દાબદબાણ સિવાય સ્વસ્થ ચિતે અને શરીરે લખી આપેલ છે , જે અમો વેચાણ આપનારને તથા અમો વેચાણ આપનારનાં હાલનાં હયાત તથા વખતો વખતનાં વંશ , વાલી , વારસો , સક્સેસરો , એસાઈનીઓ , ટ્રાન્સફરીઓ , એડમીનીસ્ટ્રેટરો , મુખત્યારો ઈત્યાદી તમામને કબુલ મંજૂર અને બંધનકર્તા છે રહેશે અને ગણાશે.

પરીશીષ્ટ-૧

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) નાં દશકોઈ તાલુકાના મોજે ગામ સીંગરવાની સીમના બ્લોક/સર્વે નંબર ૫૪૦/૦૦૧ (જુના બ્લોક/સર્વે નં.૨૧૬) ની કુલ ચોરસમીટર ૧૮૨૮ જેનો સમાવેશ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર ૧૧૮ (સીંગરવા) માં થતાં તેને ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર ૧૦૦ ની કુલ ચોરસમીટર ૧૧૫૭ ની બિનખેતીની જમીન .

સદરહુ જમીનના ખુંટચારની વિગત:-

પુર્વ :- ફાઈનલ પ્લોટ નં.૧૦૨
પશ્ચિમે :- ફાઈનલ પ્લોટ નં.૧૦૩
ઉત્તરે :- ફાઈનલ પ્લોટ નં.૨૩૭
દક્ષિણે :- ૩૦ મીટર ટી. પી. રોડ

પરીશીષ્ટ-૨

સદરહુ જમીન ઉપર બાંધવામાં આવેલ **"ASTHA UNNATI"** એ નામથી ઓળખાતી યોજનામાં આવેલ ફ્લેટો તથા દુકાનો પૈકી બ્લોક : માં ફ્લોર ઉપર આવેલ ફ્લેટ નંબર : ની આશરે સમચોરસમીટર : કાર્પેટ એરીયા તથા સમચોરસમીટર : બાલ્કની તથા સમચોરસમીટર : વોશ એરીયા (સમચોરસમીટર :બિલ્ડઅપ એરીયા)ના બાંધકામવાળી મીલકત, તથા સદરહુ યોજનામાં મુકવામાં આવેલ કોમન સીડી લીફ્ટ પેસેજના વરાડે પડતા વાપર ઉપયોગ કરવા સહીતની તથા તેમાં આવેલ ફીટીંગ લાઈટ, નળ, ગટર, કનેક્શન વિગેરે સહીતની મીલકત તથા સદરહુ યોજનાની રોડ રસ્તા તથા કોમન પ્લોટ સહીતની જમીન પૈકી સદર બાંધકામવાળી મીલકતના વરાડે પડતી વણવહેંચાયેલ હક્ક તથા હિસ્સાની સમચોરસમીટર : ની જમીન સહીતની મીલકત.

સદરહુ મીલકતના ખુંટચારની વિગત:-

પુર્વ :-

પશ્ચિમે :-

ઉત્તરે :-

દક્ષિણે :-

એ રીતેના નંબર, માપ તથા ખુંટચાર વચ્ચે આવેલ બાંધકામવાળી સદરહુ મીલકત અસલ હદ હક્કો મુજબની સદરહુ યોજનામાં મુકવામાં આવેલ રોડ, રસ્તાની જમીનમાં થઈને હરહંમેશ વાહન સહીત તેમજ વગર વાહને જવા આવવાના હક્કો સહીતની તથા તેમાં થઈને નળ ગટરના પાઈપો તથા તાર ટેલીફોનના દોરડાં વિગેરે લાવવા લઈ જવાના હક્કો સહીતની તથા સદરહુ મીલકત અંગેના અમો વેચાણ આપનારના જે જે હક્કો હોય તે તે તમામ હક્કો સહીતની સદરહુ મીલકત અમો વેચાણ આપનારએ તમો વેચાણ લેનારને આજરોજ આ વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે.

એનેક્ષર-એ

રેરા રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ

એનેક્ષર-બી

ફ્લોર પ્લાન

ઉપર મુજબનો આ વેચાણ દસ્તાવેજ અમો વેચાણ આપનારએ અમારી રાજીખુશીથી તથા અક્કલ હોંશીયારીથી, કોઈના કોઈપણ જાતના દાબ દબાણ સિવાય, વાંચી, વંચાવી, સમજી વિચારીને કરેલ છે, જે અમો વેચાણ આપનારને તથા અમો વેચાણ આપનારના હાલના તથા વખતો વખતના વંશ, વાલી, વારસો, સક્સેસરો, એસાઈનીઓ, ટ્રાન્સફરીઓ, એડમીનીસ્ટ્રેટરો, મુખત્યારો ઇત્યાદી તમામને કબુલ મંજુર અને બંધનકર્તા છે અને રહેશે.

આજરોજ તારીખ માટે, સને ૨૦૨૧ નાં દિને શહેર અમદાવાદ મધ્યે કરેલ છે.

એકતરફવાલા :-

"શ્રી હરી કોર્પોરેશન" ના
પ્રોપરાઇટર તરીકે-

.....
શ્રી સંજય રામચંદ્ર પટેલ

તેમણે તેમનું મતું નીચે
જણાવેલ બે સાક્ષીઓ રૂબરૂ
કરેલ છે.

૧)

૨)

મીલકતની ઓળખ માટેનો ફોટોગ્રાફ

મીલકતનું પોસ્ટલ સરનામું:- બ્લોક નં....., ફ્લેટ/દુકાન નં., "ASTHA UNNATI", ગામ - સીંગરવા, તા. દશક્રોધ, જી. અમદાવાદ.

વેચાણ આપનારની સહી :- -----

વેચાણ લેનારની સહી :- -----

મીલકતની ઓળખ માટેનો ફોટોગ્રાફ

મીલકતનું પોસ્ટલ સરનામું:- બ્લોક નં....., ફ્લેટ/દુકાન નં., "ASTHA UNNATI", ગામ - સીંગરવા, તા. દશક્રોધ, જી. અમદાવાદ.


વેચાણ આપનારની સહી :- -----

વેચાણ લેનારની સહી :- -----

રજીસ્ટ્રેશન અધિનિયમની કલમ-૩૨ (અ) મુજબનું પરીશીષ્ટ


વેચાણ આપનાર:-

"શ્રી હરી કોર્પોરેશન" ના
પ્રોપરાઇટર તરીકે-



શ્રી સંજય રામચંદ્ર પટેલ

વેચાણ લેનાર :-



શ્રી